



### COVID-19 મહામારી દરમિયાન બ્રમ્પટનની વસંત ઋતુ

બ્રમ્પટન, ઓન્ટારિયો (30 એપ્રિલ 2020) – ગરમીની મોસમના આગમન સાથે સીટી ઓફ બ્રમ્પટન તેના રહેવાસીઓને COVID-19ની મહામારીમાં ભૌતિક અંતર જાળવવાનું મહત્વ યાદ અપાવવા માંગે છે. સમુદાયમાં COVID-19નો ફેલાવો રોકવા રહેવાસીઓને નીચેના નિયમોને વળગી રહેવા જણાવવામાં આવે છે. જે વ્યક્તિઓ ફિઝિકલ ડિસ્ટન્સિંગ (ભૌતિક અંતર જાળવવાના) નિયમનનો ભંગ કરે તેઓને [બ્રમ્પટન COVID-19 ઈમર્જન્સી મેજર્સ બાય-લો](#) હેઠળ પ્રત્યેક ગુના માટે ઓછામાં ઓછા \$500 અને મહત્તમ \$1,00,000 દંડની જોગવાઈ છે અથવા તો તેઓએ ઈમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ સિવિલ પ્રોટેક્શન એક્ટ (EMCPA) હેઠળ દંડ ભોગવવો પડશે.

#### વસંત ઋતુની સાફસફાઈ અને ગેરેજ સેવ્સ

વર્ષના આ ભાગમાં રહેવાસીઓને વસંત ઋતુની સાફસફાઈનો લાભ લેવા માટે ગેરેજ સેવ્સ યોજવા હોય અથવા તેમાં ભાગ લેવો હોય તેમ બની શકે. EMCPA હેઠળના નિયમો મુજબ EMCPA હેઠળ તેના કારણે જાહેર જનતા સામે ઊભા થતા આરોગ્ય અને સલામતીના જોખમોને ધ્યાન પર લેતા ગેરેજ સેવ્સની પરવાનગી નથી. તેમાં વપરાયેલ માલને સ્પર્શ કરવું તેમજ ચલાવવું સામેલ હોઈ શકે છે જે COVID-19ના સર્કિસ ટ્રાન્સફર (સપાટીઓ પરથી થતો ફેલાવો)ની બિનજરૂરી તકો ઊભી કરી શકે છે. ગેરેજ સેવ્સ બિન-અનિવાર્ય વ્યવસાય માનવામાં આવે છે અને તેમાં લોકોની જાહેર મેળાવડા થવાની વક્રી છે અને સાથે જ એકબીજા સાથેની સમીપતા થઈ શકે છે. જો કોઈપણ ગેરેજ સેવ્સની જાણ થશે તો એન્ફોર્સમેન્ટ સ્ટાફ જેને ઉલ્લંઘન સામે પગલાં ભરશે અને દંડમાં પરિણમી શકે.

એપ્રિલ 20 સુધીમાં દરેક ઘર વાડામાં બે વધારાની કચરાની બેગ ગારબેજ કલેક્શન દિને કોઈ ગારબેજ ટેગ વિના મૂકી શકશે. વધારાનો કચરો બેગમાં મુકવાનો રહેશે. કન્ટેનરો અથવા કેન્સ એકત્રીત કરાશે નહીં.

કૃપા કરી નોંધી લેશો કે કલેક્શન સ્ટાફ મહત્તમ ફક્ત બે વધારાની બેગ્સ પિક અપ કરશે. રહેવાસીઓ જેમણે બેગ ટેગ ખરીદ્યા હોય તેઓને સલાહ છે કે સૂચના મળે ત્યાં સુધી તે સાચવી રાખે.

રહેવાસીઓને યાદ અપાવવામાં આવે છે કે ભારે વસ્તુઓ જે બિન કે ગાર્બેજ બેગમાં સમાય નહીં તેને અહીંથી લઈ જવાશે નહીં:

- કબ્ર પરથી;
- એપાર્ટમેન્ટ્સ/કોન્ડોમિનિયમોમાંથી; અથવા
- કમ્યુનિટી રિસાયકલિંગ સેન્ટરો (CRC) પર સ્વીકારાશે.

રહેવાસીઓને જણાવવામાં આવે છે કે મહેરબાની કરી હાથ મોજા, માસ્ક અને [ઘરનો અન્ય હેલ્થકેર કચરા](#) નો નિકાલ ગાર્બેજમાં કરવો, રિસાયકલિંગમાં નહીં.



સમગ્ર પીલમાં રહેવાસીઓને જણાવવામાં આવે છે કે તેઓ કોઈપણ દાન ડાયાબિટીસ કેનેડા બિન અથવા અન્ય સંસ્થાના ડ્રોપ ઓફ બિનમાં નાંખે નહીં જે આખા છલકાતા હોય કારણકે તે એકત્રીત કરવામાં આવનાર નથી. સ્થગિત કરેલ એકત્રીકરણ પીલના CRCને પણ લાગુ થાય છે.

જો રહેવાસીઓ માટે બિલકુલ જરૂરી હોય કે અમુક વસ્તુઓનો નિકાલ કરવો જ પડે તેમ હોય તો તે કચરો CRC પર ડ્રોપ કરી શકાશે જ્યાં આગામી સૂચના મળે ત્યાં સુધી નિકાલની ફી મુલતવી રાખવામાં આવી છે.

પીલની CRCઓ હાલ પૂરતી ઇલેક્ટ્રોનિક ચીજો, ટાયરો, મોટા અપ્લાયન્સીસ (જેમકે સ્ટવ, ફ્રિજ અને ડિશવોશરો) અથવા ભારે ચીજવસ્તુઓ સ્વીકારતી નથી.

સમુદાય અને સ્ટાફની સલામતી ખાતર CRCઓ ખાતેની સેવાઓ મર્યાદિત છે અ રહેવાસીઓએ સમજી લેવું કે પ્રતિક્ષા સમય સામાન્ય કરતા વધુ હશે.

કામકાજના કલાકો અને સ્વીકાર્ય ચીજો વિશે તાજી માહિતી માટે રહેવાસીઓને [peelregion.ca/waste/community-recycling-centres](https://peelregion.ca/waste/community-recycling-centres) પર તપાસ કરવા જણાવવામાં આવે છે.

### પાર્ક્સ અને ચેરી બ્લોસમ્સ જોવા

રહેવાસીઓને યાદ અપાવીએ કે નીચે આપેલ સિટીની મિલકતોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે:

- સ્મતના મેદાન અને પાર્કમાં રહેલ અન્ય બાંધકામો;
- લીશ-ફી ડોંગ પાર્ક;
- પિકનિક શેલ્ટરો;
- આઉટડોર સ્પોર્ટ્સ સવલતો અને આઉટડોર ફિટનેસ સાધનો જેમાં સામેલ છે બાસ્કેટ બોલ અને ટેનિસ કોર્ટ્સ;
- રિક્લિએશન સેન્ટરો અને તેની આસપાસની જમીન; અને
- પાર્કિંગ લોટ્સ

આ ચેરી બ્લોસમની મોસમમાં રહેવાસીઓને જણાવીએ છીએ કે મહેરબાની કરી તે જોવા માટે મિત્રો અને પરિવાર સાથે ભેગા મળવું નહીં. તમામ પાર્ક્સ બંધ રાખવામાં આવ્યા છે અને ભૌતિક અંતર જાળવવાના પગલાં COVID-19ને કારણે અમલમાં છે. નજીકના ભવિષ્યમાં રહેવાસીઓ ઘરે બેસીને માણી શકે તે માટે સિટી ચેરી બ્લોસમના ફૂટેજ પ્રસારિત કરશે.

### બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ

ભૌતિક અંતર જાળવવાના પગલાં અમલમાં હોવાથી સિટીનો બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ રહેવાસીઓને પ્રોત્સાહિત કરે છે કે તેઓ પોતાના ઘરોમાં જ ઉત્પાદો અને છોડ કે વનસ્પતિ ઉગાડે અને ઘરે ઉગાડેલ પાકને સ્થાનિક ફૂડ બેંક અને કમ્યુનિટી સંગઠનોને દાનમાં આપે. તે ખાતરી કરવા કે ખાદ્ય



વસ્તુઓ જરૂરિયાત ધરાવતા લોકોને સમાન રીતે વિતરિત કરવામાં આવે, એક વિનંતી પત્રક પૂર્ણ કરવા માટે સ્થાનિક ફૂડ બેંક અને કમ્યુનિટી સંગઠનોને ઉપલબ્ધ કરાશે.

રહેવાસીઓએ મફત પુરવઠો (માટી અને બિયારણ) મેળવવા માટે અહીં ઈમેલ કરવો [BramptonGreenCity@brampton.ca](mailto:BramptonGreenCity@brampton.ca). સિટી બગીચા જાળવવાનાં ટુટોરિયલો અને સૂચનો પણ અહીં શેર કરશે [www.brampton.ca/parks](http://www.brampton.ca/parks).

નવા અરજદારોને પ્રતિક્ષાસૂચિમાં ઉમેરવામાં આવશે. જે વ્યવસાયો સમાજને બિયારણ અને માટીનું દાન કરવા માંગતા હોય તેઓને અહીં ઈમેલ કરવા જણાવવામાં આવે છે [bramptongreencity@brampton.ca](mailto:bramptongreencity@brampton.ca)

મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown) બાગકામ વિશેષજ્ઞ ફ્રેંક ફેરજિની (Frank Ferragine) "ફ્રેંકી ફ્લાવર્સ (Frankie Flowers) અને બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામના પ્રમુખ અને સિટી કાઉન્સિલર ડુગ વિહલાન્સ (City Councillor Doug Whillans), વોર્ડ 2 અને 6 સાથે 4થી મે ના રોજ સાંજે 3:30 વાગ્યે ઈન્સ્ટાગ્રામ (Instagram) લાઈવ ચેટ (@patrickbrownont) યોજી રહ્યા છે. બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ વિશે વધુ જાણકારી મેળવવા અને બાગકામ વિષયક સૂચનો માટે રહેવાસીઓને ચેટમાં જોડાવા આમંત્રણ આપવામાં આવે છે.

### રિક્રિએશન એટ હોમ

તમામ સીટી ઓફ બ્રમ્પટનની સવલતો આગામી સૂચના મળે ત્યાં સુધી બંધ હોવાથી બ્રમ્પટન રોક્રિએશન રિક્રિએશન એટ હોમ શરૂ કર્યું છે જે એક વર્ચ્યુઅલ પ્રોગ્રામિંગ હબ છે જેમાં જાતજાતના વિડિયો ને બ્રિન્ટ કરી શકાય એવા ટુટોરિયલો અપાશે જેથી બ્રમ્પટનવાસીઓ સક્રિય રહે, તેમને મનોરંજન મળી રહે અને પ્રવૃત્ત રહે. તમામ વય જૂથો અને રૂચિઓને પોસવા ત્રણ અલગ ક્ષેત્રો માટે ડિજિટલ સ્ત્રોતો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે: વર્ચ્યુઅલ ફિટનેસ, એડવેન્ચર એટ હોમ ઈન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ, અને સિનિયર્સ ડિજિટલ ક્રાફ્ટ. પ્રવૃત્તિઓ માટે અહીં મુલાકાત લો [www.brampton.ca/recreation](http://www.brampton.ca/recreation) . નવા વિષયવસ્તુ દર અઠવાડિયે ઉમેરવામાં આવશે.

COVID-19ને પ્રતિસાદ આપતા સમાજને સપોર્ટ કરવાના સિટીના પ્રયાસો તેમજ ઉપરોક્ત નિર્ણયો વિશે વધુ માહિતી માટે, મુલાકાત લો [www.brampton.ca/COVID19](http://www.brampton.ca/COVID19) અથવા @CityBrampton ને Twitter, Facebook અને Instagram પર ફોલો કરો.

### મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)